

મ્યુચ્યુઅલ ફંડ SoA કે ડિમેટ : રોકાણકારો માટે કયો હોલ્ડિંગ મોડ વધુ સારો છે?

જ્યા ટે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, ત્યારે સ્કીમની પસંદગી એ નિર્ણયનો માત્ર એક ભાગ છે. રોકાણકારો પાસે તેમના યુનિટ્સ કેવી રીતે રાખવા તેનો પણ વિકલ્પ હોય છે, કાં તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અથવા રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (RTA) પાસે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ (SoA) દ્વારા, અથવા ડિમેટ એકાઉન્ટમાં. બેંકે આ પસંદગી ફંડની NAV, સિટર્ન કે ટેક્સેશનને અસર કરતી નથી, પરંતુ તે તમે તમારા રોકાણોનું સંચાલન કેટલી સરળતાથી કરો છો તેમાં તફાવત લાવી શકે છે. જે રોકાણકારો મુખ્યત્વે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, તેમના માટે SoA યુનિટ્સ રાખવા માટે એક સરખામણીએ સરળ અને સીધો રસ્તો આપે છે. રોકાણકારો માત્ર પોતાના મ્યુચ્યુઅલ ફંડ માટે ડિમેટ એકાઉન્ટ ખોલવાની જરૂર નથી.



ફંડ્સથી બનેલો છે, તેના માટે આનો અર્થ ઓછું વહીવટી સ્તર અને માત્ર રોકાણ રાખવા ખાતર ડિમેટ એકાઉન્ટ ખાતરવાની જરૂર નથી.

ડિમેટ ક્યાં અર્થપૂર્ણ બની શકે છે

જે રોકાણકારો સક્રિયપણે વિવિધ પ્રકારના બજાર-સંલગ્ન રોકાણો ધરાવે છે તેમના માટે સમીકરણ અલગ હોઈ શકે છે. આ મોડમાં SIP, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) અને સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) એટલે કે સ્વયંચાલિત કરવા પરંપરાગત રીતે ખૂબ સરળ રહ્યા છે. બીજો એક ફાયદો એ છે કે મલ્ટિપલ ફોલિયો બજારી રાખવાની લવચીકતા મળે છે. રોકાણકારો અલગ-અલગ નાણાકીય લક્ષ્યો, પસંદગીના સ્તરો અથવા રોકાણની વ્યૂહરચનાઓ માટે અલગ ફોલિયોનો ઉપયોગ કરી શકે છે, જેનાથી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને વ્યવસ્થિત કરવો સરળ બને છે. જે રોકાણકારો પોર્ટફોલિયો મોટે ભાગે મ્યુચ્યુઅલ

ફંડ્સથી બનેલો છે, તેના માટે આનો અર્થ ઓછું વહીવટી સ્તર અને માત્ર રોકાણ રાખવા ખાતર ડિમેટ એકાઉન્ટ ખાતરવાની જરૂર નથી.

ડિમેટ ક્યાં અર્થપૂર્ણ બની શકે છે

જે રોકાણકારો સક્રિયપણે વિવિધ પ્રકારના બજાર-સંલગ્ન રોકાણો ધરાવે છે તેમના માટે સમીકરણ અલગ હોઈ શકે છે. આ મોડમાં SIP, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) અને સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) એટલે કે સ્વયંચાલિત કરવા પરંપરાગત રીતે ખૂબ સરળ રહ્યા છે. બીજો એક ફાયદો એ છે કે મલ્ટિપલ ફોલિયો બજારી રાખવાની લવચીકતા મળે છે. રોકાણકારો અલગ-અલગ નાણાકીય લક્ષ્યો, પસંદગીના સ્તરો અથવા રોકાણની વ્યૂહરચનાઓ માટે અલગ ફોલિયોનો ઉપયોગ કરી શકે છે, જેનાથી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને વ્યવસ્થિત કરવો સરળ બને છે. જે રોકાણકારો પોર્ટફોલિયો મોટે ભાગે મ્યુચ્યુઅલ

ફંડ્સથી બનેલો છે, તેના માટે આનો અર્થ ઓછું વહીવટી સ્તર અને માત્ર રોકાણ રાખવા ખાતર ડિમેટ એકાઉન્ટ ખાતરવાની જરૂર નથી.

ડિમેટ ક્યાં અર્થપૂર્ણ બની શકે છે

જે રોકાણકારો સક્રિયપણે વિવિધ પ્રકારના બજાર-સંલગ્ન રોકાણો ધરાવે છે તેમના માટે સમીકરણ અલગ હોઈ શકે છે. આ મોડમાં SIP, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) અને સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) એટલે કે સ્વયંચાલિત કરવા પરંપરાગત રીતે ખૂબ સરળ રહ્યા છે. બીજો એક ફાયદો એ છે કે મલ્ટિપલ ફોલિયો બજારી રાખવાની લવચીકતા મળે છે. રોકાણકારો અલગ-અલગ નાણાકીય લક્ષ્યો, પસંદગીના સ્તરો અથવા રોકાણની વ્યૂહરચનાઓ માટે અલગ ફોલિયોનો ઉપયોગ કરી શકે છે, જેનાથી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને વ્યવસ્થિત કરવો સરળ બને છે. જે રોકાણકારો પોર્ટફોલિયો મોટે ભાગે મ્યુચ્યુઅલ

ફંડ્સથી બનેલો છે, તેના માટે આનો અર્થ ઓછું વહીવટી સ્તર અને માત્ર રોકાણ રાખવા ખાતર ડિમેટ એકાઉન્ટ ખાતરવાની જરૂર નથી.

ડિમેટ ક્યાં અર્થપૂર્ણ બની શકે છે

જે રોકાણકારો સક્રિયપણે વિવિધ પ્રકારના બજાર-સંલગ્ન રોકાણો ધરાવે છે તેમના માટે સમીકરણ અલગ હોઈ શકે છે. આ મોડમાં SIP, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) અને સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) એટલે કે સ્વયંચાલિત કરવા પરંપરાગત રીતે ખૂબ સરળ રહ્યા છે. બીજો એક ફાયદો એ છે કે મલ્ટિપલ ફોલિયો બજારી રાખવાની લવચીકતા મળે છે. રોકાણકારો અલગ-અલગ નાણાકીય લક્ષ્યો, પસંદગીના સ્તરો અથવા રોકાણની વ્યૂહરચનાઓ માટે અલગ ફોલિયોનો ઉપયોગ કરી શકે છે, જેનાથી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને વ્યવસ્થિત કરવો સરળ બને છે. જે રોકાણકારો પોર્ટફોલિયો મોટે ભાગે મ્યુચ્યુઅલ

ફંડ્સથી બનેલો છે, તેના માટે આનો અર્થ ઓછું વહીવટી સ્તર અને માત્ર રોકાણ રાખવા ખાતર ડિમેટ એકાઉન્ટ ખાતરવાની જરૂર નથી.

ડિમેટ ક્યાં અર્થપૂર્ણ બની શકે છે

વૈશ્વિક અનિશ્ચિતતા અને અલ નીનોથી લાંબા ગાળે શેરબજાર ઘટશે

અમેરિકાના ઈરાન સામે મરણીયું થઈ ગયું છે, જેની અસર વૈશ્વિક સ્તરે પડી રહી છે. ખાસ કરીને કુડ ઓઈલના ભાવ ફરી એકવાર 100 ડોલર પ્રતિ બેરલને પાર નીકળી ગયા છે, બીજી તરફ, ભારતમાં બ્રીક્સની બેઠક મળી છે, જેમાં રશિયા, ચીન તથા ભારત વચ્ચે નવા સમીકરણો સર્જવાની શક્યતા છે. જોકે, ગમે તેટલા દેશો ભેગા થાય પણ હાલના સંજોગોમાં અમેરિકા સામે બાય બીડવી સફળતા મળે તેવી સંભાવના નહીંવત જોવાઈ રહી છે. રશિયા અને ચીન ભારતનો સાથ લઈને અમેરિકાની ટ્રમ્પ સરકારને પછાડવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

વૈશ્વિક અનિશ્ચિતતાની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી શકે છે. જોકે, હાલમાં ભારતીય શેરબજાર ઓવરસોલ્ડ છે, તેથી એક બાઉન્સ બેકની અપેક્ષા રાખી શકાય છે, પણ લાંબી તેજની અપેક્ષા દેખાતી નથી.

આ સિવાય પ્રાયમરી બજારમાં આઈપીઓનો પ્રવાહ વધી રહ્યો છે. ગત સપ્તાહમાં પણ ઢગલો



કુળાવો વધે તેવી શક્યતા જોવાઈ રહી છે. નિષ્ણાતોના મતે ભારતીય શેરબજારનું ઉંચું વેલ્યુએશન હતું, તે ઘટી ગયું છે અને વિદેશી રોકાણકારો માટે ખરીદીનો સમય છે, આમ છતાં, સપ્ટેમ્બરમાં એક્ઝાઈઝાઈઝ વેચવાલ રહેતી જોવા મળી હતી. વિદેશી રોકાણકારો સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં ભારતીય શેરબજારમાંથી

2025માં તેનું વેચાણ રૂ. 1.66 લાખ કરોડ હતું. એનએસડીએલના આંકડા અનુસાર એફપીઆઈએ 11 સપ્ટેમ્બર સુધીમાં ભારતીય શેરમાંથી 13128 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ભારતીય શેરબજાર ઓવરસોલ્ડ હોવાના કારણે બજારમાં એક પ્રત્યાઘાતી ઉછાળો આવી શકે છે, પણ તે લાંબો નહીં ચાલે. જો વૈશ્વિક



ઈશ્યુ આવ્યા હતા, અને આગામી સપ્તાહમાં બીજા કેટલાક આઈપીઓ સાથે એનએસડીએલ મેગા ઈશ્યુ આવી શકે છે. આમ, સેક્ટરની બજારમાંથી પ્રાયમરી બજારમાં નાણા કલવાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાયમરી બજારમાં એક લાખ કરોડ રૂપિયા પાર થવાની તૈયારી કરી રહ્યો છે. જેથી સેક્ટરની બજારમાં આઉટફ્લો ચાલુ રહે તેવી પુરેપુરી સંભાવના જોવાઈ રહી છે.

13138 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા, કુડ ઓઈલના ભાવમાં વધારો, યુએસ બોન્ડ ચીલ્ડમાં વધારો અને મજબૂત ડોલર જેવા કારણો છે. સીડીએસએલના આંકડા અનુસાર જુલાઈ અને ઓગસ્ટમાં એફપીઆઈ ભારતીય શેરોમાં ચોખ્ખી ખરીદદાર હતી. તેમણે જુલાઈમાં રૂ. 20200 કરોડ અને ઓગસ્ટમાં રૂ. 29630 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, માર્ચથી જુન દરમિયાન સતત ચાર મહિના સુધી ભારતીય શેરોમાં વેચવાલી જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં નવીનતમ શેરના વેચાણ સાથે વિદેશી રોકાણકારોએ વર્ષ 2026માં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી રૂ. 237 લાખ કરોડ ઉપાડ્યા છે. વર્ષ

પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય તો બજારમાં ફંડો અને મોટા ખેલાડીઓ મોટો કડકો બોલાવી શકે છે. જોકે, આ કડકામાં પસંદગીના શેરોમાં રોકાણ કરીને માલ પડાવી દેવામાં આવે તેવી પણ સંભાવના છે. વૈશ્વિક અનિશ્ચિતતાની સાથે અલ નીનોની અસર પણ ભારતીય અર્થતંત્રને અસર કરી રહી છે. જેના લીધે દેશના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ પડવાની ભીતિ સેવાઈ રહી છે. જેથી રૂરલ અર્થતંત્ર નબળું રહેવાની સંભાવના છે, જેની અસર કંપનીઓના આગામી કમાણી ઉપર જોવા મળશે. આમ, લાંબા ગાળા માટે શેરબજારમાં દરેક ઉછાળો વેચવાલી વધી શકે છે, અને નફેટી 21000 પોઈન્ટ સુધી ઘટી શકે છે.

જમીન-બાંધકામ ખર્ચમાં ભારે ઉછાળાથી મધ્યમ વર્ગને મકાન બનાવવું એ સ્વપ્ન બની જશે!!!

દેશમાં દિન પ્રતિદિન મોંઘવારી વધતી જોવા મળી રહી છે. માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જ નહીં, પણ મકાન બનાવવા માટેના રે મટીરીયલ્સના ભાવો પણ ઉછળ્યા છે. જેના લીધે મકાન બનાવવાનો ખર્ચ પણ વધી ગયો છે. તેની સાથે જમીનના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમ, મકાન બનાવવાનો ખર્ચ દોઢ ગણાથી વધુ થઈ ગયો છે, જે આમ જતાં માટે સંપત્તિ બની રહેશે.



દેશનાસાત મોટા શહેરોમાં મકાનોના ભાવમાં ઝડપથી વધારો થયો છે. 2021 અને 2025ની વચ્ચે, તેઓ 59 ટકાનો ઉછાળો લગાવ્યા હતા. તે જ સમયે, મકાન બનાવવાના ખર્ચમાં લગભગ 34 ટકાનો વધારો થયો છે. એટલે કે બાંધકામ ખર્ચ કરતાં ઘણી ઝડપથી મકાનોની કિંમત વધી છે. એનારકો રિસર્ચના રિપોર્ટમાં આનું મુખ્ય કારણ જમીનના વધતા ભાવને ગણાવવામાં આવ્યું છે.

2021માં સ્ટાન્ડર્ડ-લ્ક્સ રેસિડેન્સિયલ પ્રોજેક્ટની સરેરાશ બાંધકામ કિંમત

મીડલ ઈસ્ટના તણાવના કારણે રો મટીરીયલ્સ મોંઘું થયું, મકાનના ભાવ વધારામાં બાંધકામ ખર્ચનો હિસ્સો 66 ટકાનો છે

રૂપિયા 2681 પ્રતિ ચોરસ ફૂટ હતી. 2025માં, તે વધીને રૂપિયા 3604 પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ. એટલે કે ચોર્સ લગભગ 6.9 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, 2021માં ઘરોની સરેરાશ કિંમત 5826 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી. 2025માં, તે વધીને રૂપિયા 9260 પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ. તેની વાર્ષિક વૃદ્ધિ લગભગ 12 ટકા હતી.

એનારકોના જણાવ્યા અનુસાર, મકાનોના ભાવમાં વધારામાં બાંધકામ ખર્ચ લગભગ 66 ટકા ફાળો આપ્યો હતો. બાકીનો 34 ટકાનો વધારો જમીનના ભાવ, ડેવલપરના માર્જિન અને ડિમાન્ડ-સપ્લાય જેવા પરિબળોને કારણે થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં મોટા શહેરોમાં જમીનના ભાવમાં ઝડપથી વધારો થયો છે. એનારકોના જણાવ્યા અનુસાર, મકાનોના ભાવમાં વધારામાં બાંધકામ ખર્ચ લગભગ 66 ટકા ફાળો આપ્યો હતો. બાકીનો 34 ટકાનો વધારો જમીનના ભાવ, ડેવલપરના માર્જિન અને ડિમાન્ડ-સપ્લાય જેવા પરિબળોને કારણે થયો હતો.

સસ્તા ચીની યાર્ન પરની નિર્ભરતા અને ડોમેસ્ટિક સ્પિનર્સની લાલચમાં સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ ફસાયો

સુરતને ભારતની ટેક્સટાઈલ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. લાખો પાવરલૂમ, હજારો વીવિંગ અને નિટિંગ એકમો, વિશાળ ટેક્સચરાઈઝિંગ ક્ષમતા, ડાઈંગ-પ્રિન્ટિંગ-પ્રોસેસિંગ ઉદ્યોગ અને ગારમેન્ટ તથા હોમ ટેક્સટાઈલ સાથે જોડાયેલી સમગ્ર ઔદ્યોગિક વ્યવસ્થા સુરતને દેશના સૌથી શક્તિશાળી મેન-મેડ ફાઈબર એટલે કે MMF ટેક્સટાઈલ હબ તરીકે સ્થાપિત કરે છે. પરંતુ આજે આ વિશાળ ઉદ્યોગ એક એવા નિર્ણાયક વળાંક ઉપર ઊભો છે જ્યાં માત્ર ચીનના ભાવનો પ્રશ્ન નથી. પ્રશ્ન છે સુરતના આગામી બે-ત્રણ દાયકાના ઔદ્યોગિક ભવિષ્યનો સસ્તા ચીની યાર્ન પરની નિર્ભરતા અને તેસવારોની સામી સિઝનમાં કમાઈ લેવાની રોમેસ્ટિક સ્પિનર્સની લાલચમાં સુરતનો MMF ટેક્સટાઈલ ઉદ્યોગ ફસાયો છે.

એશિયાના મુખ્ય ઉત્પાદન કેન્દ્રોમાં કાચા માલની ઉપલબ્ધતા ગંભીર રીતે મર્યાદિત થઈ ગઈ છે. ખાસ કરીને, ચીનમાં PTAનું ઉત્પાદન ઘટીને તેની ક્ષમતાના 50% પર પહોંચી ગયું છે, જેના કારણે પ્રાદેશિક નિકાસ લાઈનો બંધ થઈ ગઈ છે. યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાંથી પેરાક્સિલીન અને કૂડ ઓઈલની સપ્લાય લાઈનો પર ગંભીર અસર પડી છે.



રો-મટીરિયલના ભાવ ઘટ્યા છે, છતાં ચીનની યાર્નની આયાત અટકી છે એ સાચું છે. પણ ઊમેસ્લિટ યાર્ન ઉત્પાદકો એનો ગેરલાભ ઊભી વિવર્સનું શોષણ કરી રહ્યાં છે. દિવાળીની સિઝન પૂરી થયા પછી સુરતની વિવિંગ ઉધોગના કપરા ચઢાણ શરૂ થશે. અમારા અંદાજ

કમિટી રચવા માંગ કરી છે. ભાવ વધારાની સુરત ક્લસ્ટર પર સીધી અસર પડી છે. સુરત ક્લસ્ટરમાં દર મહિને અંદાજે 1.52 લાખ મેટ્રિક ટન પોલિએસ્ટર યાર્નનો વપરાશ થાય છે, જેમાં 60% DTYનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરે મેટ્રિક 80% ઉત્પાદન માત્ર એક જ મોટી ઉત્પાદક કંપની પાસે કેન્દ્રિત હોવાથી ભાવ નિર્ધારણમાં એક તરફી સ્થિતિ સર્જાય છે. ચીનના ઉત્પાદકોને ભારતીય ઉત્પાદકો મળતાં POY પ્રતિ કિલો રૂ. 15 સસ્તું કરતાં હોવાથી સ્થાનિક MSME વિવર્સની મૂડી ધોવાઈ રહી છે અને રોજગારી પર જોખમ ઊભું થયું છે.

અશોક જીરાવાળા વધુમાં કહે છે, “સુરત ક્લસ્ટરમાં દર મહિને 1.52 લાખ મેટ્રિક ટન પોલિએસ્ટર યાર્નનો વપરાશ છે. અનિયંત્રિત ભાવવધારાથી એમએસએમઈ વણાટકારો-રો-મટીરિયલના ભાવ ઘટ્યા છે, છતાં ચીનના ભાવમાં તે પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. યુદ્ધની સ્થિતિનો લાભ લઈને ચીનના ભાવમાં કૃત્રિમ રીતે વધારો કરવામાં આવ્યો હોય તો તેની તપાસ સરકારે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા અને એન્ટી-

એશિયાના મુખ્ય ઉત્પાદન કેન્દ્રોમાં કાચા માલની ઉપલબ્ધતા ગંભીર રીતે મર્યાદિત થઈ ગઈ છે. ખાસ કરીને, ચીનમાં PTAનું ઉત્પાદન ઘટીને તેની ક્ષમતાના 50% પર પહોંચી ગયું છે, જેના કારણે પ્રાદેશિક નિકાસ લાઈનો બંધ થઈ ગઈ છે. યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાંથી પેરાક્સિલીન અને કૂડ ઓઈલની સપ્લાય લાઈનો પર ગંભીર અસર પડી છે.

રો-મટીરિયલના ભાવ ઘટ્યા છે, છતાં ચીનની યાર્નની આયાત અટકી છે એ સાચું છે. પણ ઊમેસ્લિટ યાર્ન ઉત્પાદકો એનો ગેરલાભ ઊભી વિવર્સનું શોષણ કરી રહ્યાં છે. દિવાળીની સિઝન પૂરી થયા પછી સુરતની વિવિંગ ઉધોગના કપરા ચઢાણ શરૂ થશે. અમારા અંદાજ

કમિટી રચવા માંગ કરી છે. ભાવ વધારાની સુરત ક્લસ્ટર પર સીધી અસર પડી છે. સુરત ક્લસ્ટરમાં દર મહિને અંદાજે 1.52 લાખ મેટ્રિક ટન પોલિએસ્ટર યાર્નનો વપરાશ છે, જેમાં 60% DTYનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરે મેટ્રિક 80% ઉત્પાદન માત્ર એક જ મોટી ઉત્પાદક કંપની પાસે કેન્દ્રિત હોવાથી ભાવ નિર્ધારણમાં એક તરફી સ્થિતિ સર્જાય છે. ચીનના ઉત્પાદકોને ભારતીય ઉત્પાદકો મળતાં POY પ્રતિ કિલો રૂ. 15 સસ્તું કરતાં હોવાથી સ્થાનિક MSME વિવર્સની મૂડી ધોવાઈ રહી છે અને રોજગારી પર જોખમ ઊભું થયું છે.

એશિયાના મુખ્ય ઉત્પાદન કેન્દ્રોમાં કાચા માલની ઉપલબ્ધતા ગંભીર રીતે મર્યાદિત થઈ ગઈ છે. ખાસ કરીને, ચીનમાં PTAનું ઉત્પાદન ઘટીને તેની ક્ષમતાના 50% પર પહોંચી ગયું છે, જેના કારણે પ્રાદેશિક નિકાસ લાઈનો બંધ થઈ ગઈ છે. યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાંથી પેરાક્સિલીન અને કૂડ ઓઈલની સપ્લાય લાઈનો પર ગંભીર અસર પડી છે.

રો-મટીરિયલના ભાવ ઘટ્યા છે, છતાં ચીનની યાર્નની આયાત અટકી છે એ સાચું છે. પણ ઊમેસ્લિટ યાર્ન ઉત્પાદકો એનો ગેરલાભ ઊભી વિવર્સનું શોષણ કરી રહ્યાં છે. દિવાળીની સિઝન પૂરી થયા પછી સુરતની વિવિંગ ઉધોગના કપરા ચઢાણ શરૂ થશે. અમારા અંદાજ

કમિટી રચવા માંગ કરી છે. ભાવ વધારાની સુરત ક્લસ્ટર પર સીધી અસર પડી છે. સુરત ક્લસ્ટરમાં દર મહિને અંદાજે 1.52 લાખ મેટ્રિક ટન પોલિએસ્ટર યાર્નનો વપરાશ છે, જેમાં 60% DTYનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરે મેટ્રિક 80% ઉત્પાદન માત્ર એક જ મોટી ઉત્પાદક કંપની પાસે કેન્દ્રિત હોવાથી ભાવ નિર્ધારણમાં એક તરફી સ્થિતિ સર્જાય છે. ચીનના ઉત્પાદકોને ભારતીય ઉત્પાદકો મળતાં POY પ્રતિ કિલો રૂ. 15 સસ્તું કરતાં હોવાથી સ્થાનિક MSME વિવર્સની મૂડી ધોવાઈ રહી છે અને રોજગારી પર જોખમ ઊભું થયું છે.



મહિના માટે BCD મુક્તિ પુનઃ લાગુ કરવા અને POY- DTYની આયાત સરળ બનાવવા ભારપૂર્વક રજૂઆત કરી છે.

આ સમસ્યામાં આંશિક રાહત માટે MEG અને PTA પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી મુક્તિ તાત્કાલિક ધોરણે આગામી 6થી 12 મહિના માટે લંબાવવી.